

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૧૦/૨૦૧૭ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૨૧૮૮/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૨૮ કેસ કરી, ૧૧૪ વ્યક્તિઓને ઝડપી, ૧૧૦૬ લીટર દેશી દારૂ, ૨૨૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૫ બિયર ટીન, ૩ મોટર સાયકલ, ૨ સ્કૂટર અને ૧ ઈક્કો ગાડી કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૭ કેસ કરી ૪૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯૪,૮૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૮૯/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૦૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૧૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૨૧૯૦/૧૭

ઘાટલોડીયા: પુર્વીશ સ/ઓ સુરેશચંન્દ્ર ઠક્કર(રહે. એવરેસ્ટ ટાવર બી.આર.ટી.એસ બસ સ્ટોપની સામે, પ્રગતિનગર પાસે નારણપુર) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૧૦/૧૭ રાતના ૮/૩૦ થી તા.૨૮/૧૦/૧૭ સવારના ૧૦/૩૦ વાગ્યા દરમિયાન ઘાટલોડીયા સત્તાધાર સર્કલ પાસે ભારત પેટ્રોલ પંપની સામે મંથન કોમ્પલેક્ષમાં આવેલ ફોન હાઉસ નામની પોતાની દુકાન નંબર-૩ ના તાળા તોડી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન નં-૧૯ અને અલગ-અલગ કંપનીના મેમરી કાર્ડ નં-૨૦ મળી કુલ રૂપિયા ૭૦,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એન.વી.ચાવડા ચલાવે છે.

સોનાનો દોરો ખેચી તોડી લઈ ગયો:-

સમાચાર યાદી નં.૨૧૯૧/૧૭

માધવપુરા: રાજેશ્વરીબહેન વા/ઓ ઇન્દુભાઈ દાંતણીયા (ઉ.વ.૫૫) (રહે.સેક્ટર-૬, 'જ' ટાઇપ, સરકારી વસાહત ગાંધીનગર) તા.૨૮/૧૦/૧૭ બપોરના ૧/૪૫ વાગ્યાના સુમારે શાહીબાગ અંડરબ્રીજ હિરોહોન્ડા શોરૂમ પહેલા વૈભવ સોસાયટી નજીકથી પતિ સાથે સ્કૂટર પાછળ બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ એક પુરૂષ રાજેશ્વરીબહેનના ગળામાંથી સોનાનો દોરો પેડલ સાથે કિંમત રૂપિયા ૫૮,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ રાજેશ્વરીબહેને માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.પી.ગોહિલ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૨૧૯૨/૧૭

ઓઢવ: સંતોષભાઈ ઇનાભાઈ પટણી (રહે.રઘુવિર એપાર્ટમેન્ટ અર્બુદાનગર ઓઢવ) એ તા.૧૬/૧૦/૧૭ કલાક ૧/૦૦ વાગે રહેણાંકના પાર્કિંગમાં પોતાની બોલેરો પીકઅપ ગાડી નંબર જી ૧ ઓઝેડ ૪૯૫૨ કિમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી સવારના ૬/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ સંતોષભાઈ પટણીએ તા.૨૮/૧૦/૧૭ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.ડી.ભટ્ટ ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:

સમાચાર યાદી નં.૨૧૯૩/૧૭

દાણીલીમડા: તા.૨૮/૧૦/૧૭ બપોરના ૧/૩૦ વાગ્યાના સુમારે કોઝી હોટલની બાજુમાં પરષોત્તમ એસ્ટેટ કેમીકલની દુકાનમાં અકસ્માતે આગ લાગતા પોકરરામ ભારતરામ વિષ્ણોઈ (ઉ.વ.૪૦) (રહે.રાજપથ બંડ્લોઝ ઘોડાસર) આગમાં ફસાઈ જતા દાઝી જતા તેમનું મૃત્યુ નિપજયું હતુઆ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.ઈ.શ્રી આર.કે.અમીન ચલાવે છે.

ઝેરી જીવજં તુકરડતા મૃત્યુ:

સમાચાર યાદી નં.૨૧૯૪/૧૭

નારોલ: તા.૨૮/૧૦/૧૭ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે કનુભાઈ વેલાજી ઠાકોર (રહે.ગેસપુર મુખીવાસની પાછળ નારોલ) નો પુત્ર ઉમંગ (ઉ.વ.૨) પોતાના ઘરે રમતો હતો ત્યારે કોઈ ઝેરી જીવજં તુ પગ ઉપર કરડી જતાં સારવાર માટે તેને વાસા.હોસ્પીટલમાં લઈ જતા ફરજ પરના ડોશ્રીએ મૃત જાહેર કર્યો હતો. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી જે.બી.રાહોડ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૧૯૫/૧૭

શહેરકોટડા: જયનીકાબેન ઉર્ફે રીંકુ ડો/ઓ અશ્વિનભાઈ પ્રીયદર્શી (ઉ.વ.૩૧) (રહે. સુરભી એપાર્ટમેન્ટ ઇટવાડા સરસપુર) એ અગમ્ય કારણસર તા.૨૭/૧૦/૧૭ કલાક ૧/૫૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રમેશભાઈ શંકરભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.